

ત્વરિત જાહેરાત માટે

પૃથ્વી મહિનો (અર્થ મન્થ) બ્રેમ્પટનમાં ઉજવો!

ઉદ્યાનોની સફાઈ, સીટીની પહેલી પૃથ્વી દિવસ (અર્થ ડે) પર્યાવરણલક્ષી ઉજવણી અને વૃક્ષારોપણ માટે નોંધણી કરાવો.

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (એપ્રિલ 1, 2022) – એક હરિયાળા શહેર તરીકે, બ્રેમ્પટને કાયમી પ્રયત્નો કરીને આગળ વધવાનું અને પર્યાવરણ પર પોતાનો પ્રભાવ ઘટાડવાનું ચાલુ રાખ્યું છે. આ એપ્રિલમાં, સીટીની સામુદાયિક પર્યાવરણલક્ષી પહેલોમાં ભાગ લઈને પૃથ્વી મહિનો (અર્થ મન્થ) ઉજવો.

ઉદ્યાનોની સફાઈ – એપ્રિલ 1

વર્ષ 2022 માટે બ્રેમ્પટનના ઉદ્યાનોની સફાઈ કામગીરી ચાલુ છે. રહેવાસીઓ એપ્રિલ 1 થી નવેમ્બર 1 સુધી પોતાની પસંદગીના ઉદ્યાનમાં સફાઈ કામની આગેવાની કરવા સ્વયંસેવક બની શકે છે. સીટી મે મહિનામાં સંગઠિત સફાઈ કાર્યક્રમોનું આયોજન પણ કરશે, જેમાં દરેક વોર્ડની જોડી બનાવવાનો કાર્યક્રમ અને મફત સામુદાયિક બારબેક્યુ સામેલ રહેશે. વધુ માહિતી જાણવા અને તમારી સફાઈ કામગીરી માટે મફત સાધનો મેળવવા વેબસાઈટ www.brampton.ca/cleanup પર નોંધણી કરાવો.

પર્યાવરણલક્ષી ઉજવણી અને ગ્રો ગ્રીન એવોર્ડ્સ સમારોહ – એપ્રિલ 23

સીટી ઓફ બ્રેમ્પટનની પહેલી પર્યાવરણલક્ષી ઉજવણી અને [ગ્રો ગ્રીન એવોર્ડ્સ](http://www.brampton.ca/greenawards)માં જોડાઈ જાવ! સીટી શનિવાર, એપ્રિલ 23 નાં રોજ સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધી નોર્ટન પ્લેસ પાર્કમાં, કોટ્ટોબિક-અનુકૂળ પ્રવૃત્તિઓનું આયોજન કરશે અને સમુદાયમાં પર્યાવરણલક્ષી અગ્રણીઓને નવા ગ્રો ગ્રીન એવોર્ડ્સ રજૂ કરશે. વિગતો અને આ પ્રસંગ માટે નોંધણી કરાવવા [અહીં](http://www.brampton.ca/greenawards) ક્લિક કરો.

વૃક્ષારોપણ – એપ્રિલ 24

ટોરોન્ટો રીજીયન કન્ઝર્વેશન ઓથોરિટી (TRCA) સાથેની ભાગીદારીમાં, સીટી રવિવાર, એપ્રિલ 24 નાં રોજ સવારે 10 થી બપોરે 12 વાગ્યા સુધી ગૌર મીડોસ કમ્યુનિટી સેન્ટરમાં મફત વૃક્ષારોપણ કાર્યક્રમ કરશે. નોંધણી અનિવાર્ય છે. વિગતો માટે અને નોંધણી કરાવવા વેબસાઈટ www.brampton.ca/parks જુઓ.

અવતરણો (ક્વોટ્સ):

“બ્રેમ્પટન એક હરિયાળુ શહેર અને ટકાઉપાણું અને આબોહવા ફેરફારના પ્રયત્નોમાં અગ્રણી છે. આ ફેરફારનો ભાગ બનો – ઉદ્યાનોની સફાઈમાં જોડાઈ જાવ, વૃક્ષારોપણ કરો અને આ મહિને અમારી પહેલી પૃથ્વી દિવસ (અર્થ ડે) પર્યાવરણલક્ષી ઉજવણી અને ગ્રો ગ્રીન એવોર્ડ્સ સમારોહમાં હાજર રહો.”

- પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

“બ્રમ્પટનની પર્યાવરણલક્ષી પહેલો આપણી કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવામાં અને વર્ષ 2050 સુધીમાં આપણાં શહેરમાં ઉત્સર્જિત ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન 80 ટકા જેટલું ઘટાડવામાં ફાળો આપે છે. હું આ મહિને અને આખું વર્ષ પહેલોમાં સહભાગી થઈને આપણાં શહેરને સાફ અને હરિયાળુ રાખવામાં મદદ માટે દરેક વ્યક્તિને પ્રોત્સાહિત કરું છું.”

- પૉલ વિસેંટે (Paul Vicente), પબ્લિક વર્ક્સ એન્ડ એન્જનીયરિંગ; પ્રાદેશિક કાઉન્સિલર, વોર્ડ્સ 1 અને 5, સીટી ઓફ બ્રમ્પટન

“અમે બહુ હરિયાળા શહેર માટેના જીવનલક્ષ્ય પર છીએ, જેની ઝાંખી કમ્યુનિટી એનર્જી એન્ડ એમિશન્સ રિડક્શન પ્લાન (CEERP) અને કાઉન્સિલની અગ્રતાની પરિભાષામાં જણાવી છે. આ મહિને, હું રહેવાસીઓને પર્યાવરણ માટે કંઈક કરવા પડકારું છું. રહેવાસીઓ આપણાં ઉદ્યાનોની સફાઈ કરવામાં, વૃક્ષારોપણ કરવામાં, અર્થ રૂ ઉજવાણીમાં હાજર રહેવામાં, અથવા પોતાની પસંદગીની અન્ય હરિયાળી પહેલો પૂરી કરવામાં મદદ કરી શકે છે.”

- ડગ વ્હિલ્લન્સ (Doug Whillans), સીટી કાઉન્સિલર, વોર્ડ્સ 2 અને 6; સભ્ય, એન્વાયરોન્મેન્ટ એડવાઈઝરી કમિટી; સભ્ય, CEERP કમ્યુનિટી ટાસ્ક ફોર્સ, સીટી ઓફ બ્રમ્પટન

“સીટી ઓફ બ્રમ્પટન પોતાના આબોહવા ફેરફાર લક્ષ્યોને પહોંચી વળવા, ટકાઉપણું સુધારવા અને આપણાં સમુદાયમાં પર્યાવરણલક્ષી ધોરણો વધારે તીવ્ર બનાવવા સમર્પિત છે. આ એપ્રિલમાં પર્યાવરણલક્ષી પહેલોમાં સહભાગી થાવ, અને વધુ જાણવા વેબસાઈટ Brampton.ca જુઓ.”

- પૉલ મોરિસન (Paul Morrison), વચગાળાના CAO, સીટી ઓફ બ્રમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રમ્પટનમાં 7,00,000 કરતા વધુ લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](https://twitter.com/Brampton), [Facebook](https://facebook.com/Brampton), અને [Instagram](https://instagram.com/Brampton) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca.

મિડિયા સંપર્ક (MEDIA CONTACT):

સીટી ઓફ બ્રમ્પટન મલ્ટિકલ્ચરલ મિડિયા

multiculturalmedia@brampton.ca